



પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીની કચેરી,  
ઇસનપુર પોલીસ સ્ટેશન અમદાવાદ શહેર



ટે.નં.- 079-25430180 ઇ-મેઇલ:-[polstn-isanapur-ahd@gujarat.gov.in](mailto:polstn-isanapur-ahd@gujarat.gov.in)

## પ્રેસનોટ

દેશી દારૂની ખેપ મારતી મહીલા બુટલેગરોને પકડી પાસા અટકાયત હેઠળ રાજકોટ -ભુજ-સુરત  
જેલ ખાતે મોકલી આપતી ઇસનપુર પોલીસ

મે.પોલીસ કમિશ્નર સાહેબ શ્રી અમદાવાદ શહેર તથા મે.અધિક પોલીસ કમિશ્નર શ્રી સેક્ટર-૨ સાહેબ તથા નાયબ પોલીસ કમિશ્નર શ્રી ઝોન-૬ સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશ્નર શ્રી “જે” વિભાગ સાહેબ નાઓ તરફથી વધુમાં વધુ પાસા અટકાયતી પગલા લેવાની સુચના આપતા જે સુચના આધારે “જાહેર સલામતી અને વ્યવસ્થા” વિરૂધ્ધના કૃત્યો અટકાવવા સારૂ અસરકારક પગલા લેવા કરેલ હુકમ અનુસંધાને સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એમ.સોલંકી ઇસનપુર પોલીસ સ્ટેશનનાઓએ નીચે જણાવેલ નામ વાળા આરોપી “જાહેર વ્યવસ્થા” વિરૂધ્ધના કૃત્યો કરતો હોય તેના વિરૂધ્ધમાં પુરાવા એકત્ર કરી પાસા દરખાસ્ત તૈયાર કરી મે.પોલીસ કમિશ્નરશ્રી અમદાવાદ શહેરનાઓની સમક્ષ સાદર કરતા તેઓ સાહેબે પાસા હુકમ (૧) ક્રમાંક નં- પીસીબી/ડીટીએન/ પાસા/૧૦૩૭/૨૦૧૯ તા-૦૯/૦૯/૨૦૧૯ થી પાસા અટકાયતી મંજુલાબેન વા/ઓ ભાનુભાઇ રયજીભાઇ જાતે તળપદા ઉ.વ. ૩૦ ધંધો-ખેત મજૂરી રહે ગામ ગુતાલ મહાદેવનુ ફળીયુ તા. નડીયાદ જી.ખેડા નાઓને મધ્યસ્થ જેલ ભુજ તથા (૨) પાસા હુકમ નંબર પીસીબી/ડીટીએન/પાસા/૧૦૩૮/૨૦૧૯ તા:૦૯/૦૯/૨૦૧૯ થી પાસા અટકાયતી પીંકીબેન વા/ઓ ભરતભાઇ મોહનભાઇ જાતે તળપદા ઉ.વ ૨૫ ધંધો-ખેત મજૂરી રહે ગામ ગુતાલ મહાદેવનુ ફળીયુ તા.નડીયાદ જી. ખેડા નાઓને રાજકોટ જેલ ખાતે તેમજ (૩) પાસા હુકમ નંબર પીસીબી/ડીટીએન/પાસા/૧૦૩૯/૨૦૧૯ તા:૦૯/૦૯/૨૦૧૯ થી પાસા અટકાયતી શારદાબેન વા/ઓ કનુભાઇ જશભાઇ જાતે તળપદા ઉ.વ ૩૩ ધંધો-ખેત મજૂરી રહે ગામ ગુતાલ મહાદેવનુ ફળીયુ તા. નડીયાદ જી.ખેડા નાઓને સુરત જેલ ખાતે પાસા અટકાયતમાં રહેવાનો હુકમ કરતા અમો પોલીસ ઇન્સ્પેક્ટર જે.એમ.સોલંકી ઇસનપુર પોલીસ સ્ટેશન નાઓએ સદરી ત્રણેય પાસા અટકાયતીને પકડવા સુચના કરતા સર્વેલન્સ સ્કવોડના પો.સ.ઇ.શ્રી વી.એન.ભરવાડ તથા સર્વેલન્સ સ્કવોડના અપોકો નારણભાઇ કરસનભાઇ નાઓની બાતમી હકીકત આધારે મહિલા લોકરક્ષક પુજાબેન પ્રમોદભાઇ તથા મહિલા લોકરક્ષક અનીતાબેન બચુભાઇ નાઓ સાથે રાખી ત્રણેય મહીલા બુટલેગરોને પકડી પાડતા સદરી ત્રણેય મહિલા બુટલેગરોને આજ રોજ તા-૧૦/૦૯/૨૦૧૯ ના રોજ પકડી હુકમની બજવણી કરી જરૂરી જાપ્તા સાથે પાસા અટકાયતમાં રહેવામાં સારૂ અલગ અલગ જેલમાં મોકલી આપેલ છે. તા-૧૦/૦૯/૨૦૧૯



મંજુલા - શારદા - પિંકી

(જે.એમ.સોલંકી)  
સીનીયર પોલીસ ઇન્સ્પેક્ટર  
ઇસનપુર પોલીસ સ્ટેશન  
અમદાવાદ શહેર